

# East Asia Summit Senior Officials' Meeting (EAS SOM)

June 24, 2021

## ઈસ્ટ એશિયા સમિટ વરિષ્ઠ અધિકારીઓની બેઠક (EAS SOM)

June 24, 2021

1. સેક્રેટરી (ઈસ્ટ) શ્રીમતી રિવા ગાંગુલી દાસે 24 જૂન 2021ના રોજ ઈસ્ટ એશિયા સમિટ વરિષ્ઠ અધિકારીઓની બેઠક (ઈએએસ એસઓએમ)માં ભાગ લીધો હતો. આ વર્ચ્યુઅલ બેઠકનું અધ્યક્ષપદ બ્રુનેઈ દારુસલામના કાયમી સચિવ મહામલિમ ઈમાલિન અબ્દુલ રહેમાન તાઓએ સંભાળ્યું હતું. તેમાં 18 ઈએએસ દેશોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

2. બેઠકમાં લીડર્સની આગેવાની હેઠળના ઈએએસ પ્લેટફોર્મને મજબૂત બનાવવાના તથા ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને તેને વધુ અસરકારક અને સક્રિય બનાવવાના માર્ગો અને ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓએ હાલની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે પણ પોતાના વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું જેમાં કોવિડ-19 મહામારી અને મહામારી પછીની રિકવરી, સાઉથ ચાઇના સમુદ્ર, કોરિયન પ્રદેશ, મ્યાનમારમાં થતી હિલચાલ અને ત્રાસવાદનો સમાવેશ થાય છે. બેઠકમાં સભ્ય દેશોએ ઈએએસ માળખા હેઠળ કરેલી પ્રતિબદ્ધતા અને મનીલા પ્લાન ઓફ એક્શન (2018-2022)ના અમલીકરણમાં થયેલી પ્રગતિ વિશે સમીક્ષા કરવામાં આવી હતી.

3. સેક્રેટરી (ઈસ્ટ)એ પોતાની ટિપ્પણીમાં બ્રુનેઈ દારુસલામે આસિયાન અને આસિયાનના નેજા હેઠળના મિકેનિઝમમાં ભજવેલી નેતૃત્વની ભૂમિકાને ભારત વતી બિરદાવી હતી. તેમણે ઈએએસ દ્વારા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ઈએએસ દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકા પર ભાર મુક્યો હતો. તથા તેને વધુ મજબૂત અને પ્રતિભાવશીલ બનાવવા માટે ભારતના ટેકાનો પુનરોચ્ચાર કર્યો હતો. આસિયાનને કેન્દ્રમાં રાખીને મુક્ત, ખુલ્લા, સમગ્રલક્ષી અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર રચવાના મહત્વ પર તેમણે ભાર મુક્યો હતો. તેમણે આસિયાન આઉટલૂક ઓન ઈન્ડો-પેસિફિક (એઓઆઈપી) અને ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઈનિશિયેટિવ (આઈપીઓઆઈ) વચ્ચે મજબૂત જોડાણની નોંધ લીધી હતી જે પ્રાદેશિક સહકાર વધારવા માટે સામાન્ય આધાર પૂરો પાડે છે.

4. મુલાકાત દરમિયાન સેક્રેટરી (ઈસ્ટ)એ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરીને સાઉથ ચાઇના સમુદ્રમાં શાંતિ અને સ્થિરતા, નેવિગેશન તથા ઉપરથી ઉડાનની સ્વતંત્રતા જાળવી રાખવામાં ભારતના રસ પર ભાર મુક્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે જે આચારસંહિતાની વાતચીત ચાલે છે તેમાં ત્રીજા પક્ષના વાજબી હિતો જોખમાવાન જોઈએ અને તે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (યુએનસીએલઓએસ)ની સાથે સંપૂર્ણપણે સાતત્યપૂર્ણ હોવા જોઈએ.

5. મ્યાનમારમાં થતી ઘટનાઓ અંગે તેમણે આસિયાન પ્રક્રિયા માટે ભારતને ટેકો જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે મ્યાનમારના મિત્ર અને નિકટના પડોશી તરીકે ભારત હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં રચનાત્મક અને અર્થપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. તેમણે અન્ય મુદ્દાઓ ઉપરાંત ત્રાસવાદના મુદ્દે પણ ભારતનું વલણ રજૂ કર્યું હતું.

નવી દિલ્હી

જૂન 24, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.